

## કાચ્ય-કુસુમો

--પ્રદૂમન તના॥

### ૧. છીળ

અહકી ગાઈ

નેણા અચીંતી રંગની છાકમણોળ!

ઉપર ભૂરાં આખ ને નીચે સોનલવરણાં ખેત  
વચમાં હેતું જાય સુપેરી હેણ વળાંકા લેત,  
જંબળી આંકે રેખ આધેરી હુંગરીયાની ઓળ  
આધેરી હુંગરીયાની ઓળ!

અહકી ગાઈ નેણા અચીંતી રંગની છાકમણોળ!

ઉતરે ઓલ્યું રાન-સુહાનું જુમખું લેતું જોક  
અહીં તહીં ખડમોરની વળી કાબરી ભોળું ડોક,  
દીસતું નહીં તોય રે મીઠા ગાનથી જાણું કોક  
પીળચટી થોરવાડની આહે સુર જરે ચંડોળ  
જીણેરા સુર જરે ચંડોળ!

અહકી ગાઈ નેણા અચીંતી રંગની છાકમણોળ!

હળવી વાયે દખજાદીની કુલગુલાબી હેર,  
દુર પણે ઓ હેલતો લીલો અમરાઈનો ઘેર  
માંધથી મીઠી મહેંકની હારે ઉત્તી આણી મેર  
જળ-થળે ઝાંય રેલતી આવે ચુંદળી રાતીચોળ  
હીરાગળ ચુંદળી રાતીચોળ!

અહકી ગાઈ નેણા અચીંતી રંગની છાકમણોળ!

(૧૯૫૮)

### ૨. રત્ય

કોણ કે'છે કે રત્ય રુડી સરી?!  
રંગ રંગ છોખ્ય એની ઓસરતાં મોખ્ય  
અમીં ચીતને ચંદરવે લીધ ભરી!  
કોણ કે'છે કે રત્ય રુડી સરી?!

મધુવનની ભોય શા મજુઠ લાલ પોત પરે  
જાંતે આજોખી ભલી ભાત્ય,  
કેવહાની મહેંક મહેંક કુજ ચારે કોર્ય, બીચ  
મોરલા ને કીર કરે વાત્ય.

એ જી ધારો ધારો તે હંયે પોરવ્યો હુલાસ  
 ને ગુજરતાં ગીત્યુંની કરી!  
 કોણ કે'છે કે રત્ય રૂડી સરી?!

આભલીયે આભલીયે ટાંક્યું અંકશ  
 ને અંકશે દા'ડી ને રેણ,  
 દા'હે દા'હે તે ભય્યાં અંજવાળાં ઝોક  
 ને રેણ ભય્યાં ચંદનીનાં ઘેન,  
 એ જ ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો  
 ઉજાગરે ગલાલની ઝડી!  
 કોણ કે'છે કે રત્ય રૂડી સરી?!

માણિ પરમાણિને ઝીણું મોટું જેહ કાંઈ  
 ભરી લઈ ભીતર મોઝાર,  
 એવું ને એવું રીયે જળવાયું, આછોયે  
 આવતો ન એને ઓસાર,  
 એ જ આપણે ઉબેળવાની ખોટી કે પરથમ શું  
 પ્રગટે સંધુય ફરી ફરી!  
 કોણ કે'છે કે રત્ય રૂડી સરી?!

(૧૮૮૭)

### ૩. નીદાન

પીજય રહી હંયે સહુ શમી!  
 ઓસરીયાં ખરે હવે ખપતાં ના કોઈ  
 ભલું રોગનું નીદાન કીદું તમીં!

ઓળખી અજંપ જો કારણ પુછ્યું તો વ્યો  
 કાળજ તમારી કને ખોલ્યું.  
 મારણ ઘો એવું કે ઘડી ઘડી આવતી  
 અટકે અકારી બધી મોળ્યું  
 (ન) ભય્યાં ભય્યાં થાળ થકી ભોજનને ભાવતાં  
 નવલે આસ્વાદ હું જમી!  
 પીજય રહી હંયે સહુ શમી...

હળવું હસીને નાડ જાલતાં કીદું રે તમીં,  
 'ભીતર હો'વાય ભલે ખારે.  
 જેટલો છે માંદ્ય ઈથી અદકો થઈ ઉભરે  
 આપણે જો ઓકી દઈ જારે!  
 પલટાતાં રૂપ બચા! આપોઆપ ઓસરશે

થોડું તે ખાવ તમીં ખમીા’  
પીજય રહી હાર્યે સહુ શમીા...’

વાગોળું વેણાઈ દા’ તી ને રેણા અહો  
કળતર શી આઇરતી કોઠે.  
ક્યારેયે માણી ન’તી એટલી મીઠાશ કળું  
હળુ હળુ ઉભરતી હોઠે!  
સાચું મા! સાચું રોજેરોજ પરમાણું કે  
જરવેલાં ઝેર ઈ જ અમી!  
પીજય રહી હાર્યે સહુ શમી...  
(૧૯૭૮)

#### ૪. રાત્રી ટાકો ‘કોમો’

(‘કોમો’-ઈટલીનું નગર, જ્યાં કવીંદંપતી રહે છે)

નીતર્યું પણ અતી ગાહું  
હે આજ રાત્રીનું આબ.  
અલોપ થઈ ગયા છે હુંગારા,  
અવકાશ મહીં  
લટકાતાં છોડી  
તેજનાં જુમખાં,  
ટોચનો તર્પણા-કોસ,  
ને બારાએટ્લો-બુરજના  
સ્તબ્ધ રૂપેરી માળખાં.  
કેથેરુલનો ભારેખમ ગુંબજ  
પણ અધ્યર ભાસે છે  
અંધારી દીવાલો થકી...  
કેવળ કાંઠાની વંકાતી  
પાળી થકી વરતાતાં શ્યામલ જલ  
આંકયા કરે છે વણથંભ,  
અરબી શા  
ધોળાં  
પીળાં  
લાલ  
ભુરાં  
આળોખ...  
(૧૯૮૮)

--પ્રદ્યુમન તના

‘સન્ને ઈ-મહેશીલ’ -- વર્ષ: બે -- અંક: ૮૮ -- ફેબ્રુઆરી ૧૧, ૨૦૦૭  
‘સન્ને ઈ-મહેશીલ’ માટે ‘ઉંઝોઝણી’ અને ‘વીજ્યા’ ફૈન્ટ’માં : અક્ષરાંકન: [uttamgajjar@hotmail.com](mailto:uttamgajjar@hotmail.com)



**કવી પરીચય  
“ઈ તો સાંયડી રોપી છે, ભલા!”**

ભગવાન બહુ ઓછાને પ્રદૂમનભાઈના જેવું વરદાન આપે છે. પતીભાઓનો ભરેલો કુંભ એટલે પ્રદૂમન તના. ગુજરાતના પ્રથમ પંક્તીના ચીત્રકાર એટલે પ્રદૂમનભાઈ. ગુજરાતના પહેલી હરોળમાં બેસી શકે એવા મોટા ગજાના કવી—લેખક એટલે પ્રદૂમનભાઈ. ગુજરાતની આબરૂ જગમાં વધારનારા ફોટોગ્રાફર એટલે પ્રદૂમનભાઈ. નવાઈની વાત એ છે કે એમનું મોટા ભાગનું જીવન ગુજરાતની બહાર વીત્યું છે. આવતી પેઢીને છાંયડો મળે એટલે માતૃભાષાનો છોડ ઈટાલીમાં વાવ્યો છે. કે એમ કહો કે પાંચ દાયકાથી એક ગુજરાતની નાગર-વેલ ઈટાલી સુધી પાંગરી છે.

આ મહેઝીલનાં એમનાં કાવ્યો વાંચ્યાં? સમ ખાવા પડે કે કવી પાંચ દાયકાથી ગુજરાત બહાર રહે છે; તેમ છતાં તેમણે સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પદેશને પોતાના કેમેરાથી નાથવા, પોતાની પીંછીથી કંડારવા અને પોતાની કલમથી આવેખવા, ખુંદી નાખ્યા છે. આ ગુજરાતી જે કાંઈ હાંસલ કરી શક્યો છે તેનો બધો જશ એમનાં અધર્ગીની, રોજાલ્બાને જાય છે(આ વાત સાથે તેઓ તરત સંમત થશે). લગભગ પચાસ વરસ પહેલાંનું, એક છેલ છબીલા ગુજરાતી અને એક ઈટાલીયન લલનાનું પ્રેમલઘન એમના ચાહકો માટે પણ મંગલમય નીવર્દ્ધયું. આજે આ કવીને ઈટાલીયન ભાષાના મુશાયરામાં પણ પોતાની ઈટાલીયન કવીતાઓ વાંચવાનાં નીમંત્રણો મળે છે!

એમના પુસ્તક ‘શ્રીજી’ ને ગુજરાત સાહીત્ય અકાદમીનું ‘શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ’નું પારીતોષીક પણ મળ્યું છે. ભાષા શું છે, કાવ્ય શું છે તે જાણવું હોય તો આ પુસ્તક વાંચો. તણ ગુજરાતની ભાષા અને સૌરાષ્ટ્રના કસુંબાનો નશો કરવો હોય તો પ્રદૂમન તનાને માણો.

**–હરનીશ જાની (ન્યુ જરી) અને ઉત્તમ ગજજર (સુરત)**

**સર્જકનો સંપર્ક:** [pradumnatana@tele2.it](mailto:pradumnatana@tele2.it)



માત્ર તેર માસના ગાળામાં **2,10,000** જેટલા ભાષાપ્રેમીઓએ અત્યાર સુધીમાં

<http://www.gujaratilexicon.com> લેક્સિકોનની મુલાકાત લીધી. આપને પણ લેક્સિકોનની આ નવી **interface**ની મુલાકાત લેવાનું નીમંત્રણ છે.

આપ સૌના સહયોગ થકી સંકે ઈ-મહેશ્વિલના ચાર હજાર જેટલા વાચકો થયા અને રોજેરોજ નવાં નામો ઉમેરાતાં જાય છે એ પુરવાર કરે છે કે, દેશવીદેશમાં ગુજરાતી વાચનના રસીયા બહુ મોટી સંખ્યામાં છે જ...

સૌનો આભાર.. સંકે ઈ-મહેશ્વિલની અત્યાર સુધીની જુની સઘળી પીડીએક ફાઇલો અમારી

<http://sundaymahefil.googlepages.com/> વેબસાઈટ પરથી તથા

<http://gujaratilexicon.com/index.php?action=downloadSeM> પરથી પણ સરળતાથી ડાઉનલોડ થઈ શકશે. આ જ વેબ સાઈટ પરથી લેક્સિકોન અને ઓપીનીયનની મુલાકાતે પણ જઈ શકશે..

શ્રી. પ્રવીષ વાધાણી (મેલ્બોર્ન-ઓસ્ટ્રેલીયા) તરફથી પ્રકાશીત થતું 'માતુભાષા' માર્સીક પણ હવે ત્યાં મુકાશે.

Kindly send your suggestions to

Ratilal Chandaria, e-mail:[rpchandaria@comcraft.com](mailto:rpchandaria@comcraft.com)

◆◆◆ મધુરેણ સમાપ્યેત ◆◆◆

### KANYADAAN



And here are the warranty papers...., no returns, no exchange !!

મહેન્દ્રભાઈનો ઈ-મેઈલ સંપર્ક : [mahendraaruna@msn.com](mailto:mahendraaruna@msn.com)

web site : [www.ameamericanamdavadi.com](http://www.ameamericanamdavadi.com)

'સંકે ઈ-મહેશ્વિલ' -- વર્ષ: બે -- અંક: ૮૮ -- ફેબ્રુઆરી ૧૧, ૨૦૦૭

'સંકે ઈ-મહેશ્વિલ' માટે 'ઉત્તમાજોહરણી' અને 'વીજયા' શીન્ટ'માં : અક્ષરાંકન: [uttamgajjar@hotmail.com](mailto:uttamgajjar@hotmail.com)

◆◆◆ ● ◆◆◆ ● ◆◆◆